







**Ministry of Housing and Environment**

Ref No.: (IUL) 18-FS1/138/2012/13

Date: 25th January 2012

**REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)**  
**REQUEST FOR PROPOSAL**  
**COMMUNITY TRAINING**

Ministry of Housing and Environment (MHE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a community training programme at provincial level.

The main objective of the training is to identify and develop community groups at provincial level through awareness and capacity building programs.

The Ministry of Housing and Environment now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from Ministry of Housing and Environment.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1400 hours (local time) before 13th February 2012 by regular mail.

Project Director  
Regional Development Project – Phase –II, ADB Loan  
2170 MLD (SF)  
Ministry of Housing and Environment  
Ameenee Magu, Maafannu  
Male', Republic of Maldives  
Tel: +960 3004300 Fax: +960 3004301  
E-mail: [secretariat@mhte.gov.mv](mailto:secretariat@mhte.gov.mv)  
Web site: [www.mhe.gov.mv](http://www.mhe.gov.mv)

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް އަދި ފަރާތްތަކާ ބެހޭ ކަމުގެ ސަރުކާރުގެ މިނިސްޓްރީގެ  
އެކުލަވަލު، ދިވެހިސަރުކާރުގެ

(IUL) 18-FS1/138/2012/13 : ސަރުކާރުގެ މިނިސްޓްރީ

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
2170 2170 2170 (މިލިއަން ދިވެހިރުޅި)

**ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ**

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ

ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
2170 2170 (މިލިއަން ދިވެހިރުޅި)  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ  
ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ ސަރުކާރުގެ

25 ޖެނުއަރީ 2012

**Ministry of Housing and Environment**

Ref No.: (IUL) 18-FS1/138/2012/10

Date: 25th January 2012

**REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)**

**REQUEST FOR PROPOSAL**

**CORPORATE MANAGEMENT TRAINING**

Ministry of Housing and Environment (MHE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a corporate management training programme for a selective group of candidates.

The main objective of the training is to develop and enhance corporate skills and management for a selective group of candidates.

The Ministry of Housing and Environment now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from Ministry of Housing and Environment.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1400 hours (local time) before 13th February 2012 by regular mail.

Project Director  
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)  
Ministry of Housing and Environment  
Ameenee Magu, Maafannu  
Male’, Republic of Maldives  
Tel: +960 3004300 Fax: +960 3004301  
E-mail: [secretariat@mhte.gov.mv](mailto:secretariat@mhte.gov.mv)  
Web site: [www.mhe.gov.mv](http://www.mhe.gov.mv)

މިސަބަބުގެ ތެރެއިން ދިވެހިސަރުކާރުގެ ސަރުކާރުގެ ދާއިރާގެ ބޭނުންތަކަށް  
އިތުރު ފަލާ ދިނުމަށް

(IUL) 18-FS1/138/2012/10 : ސަރުކާރުގެ ބޭނުން

ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
2170 ޕްލާން (އެ.އެ.އެ.އެ.އެ.)

**އިންޓަނެޓް ސަރުކާރުގެ ސަރުކާރުގެ ފަރާތުން ދިނުމަށް ފަލާ ދިނުމަށް**

ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް

މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން

މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން

މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން

މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން  
މި ސަރުކާރުގެ ބޭނުންތަކަށް ފަލާ ދިނުމަށް ބޭނުންވާ ފަރާތްތަކުން

25 ޕްލާން 2012

**Ministry of Housing and Environment**

Ref No.: (IUL) 18-FS1/138/2012/12

Date: 25th January 2012

**REGIONAL DEVELOPMENT PROJECT PHASE-II – ADB LOAN 2170 MLD (SF)**  
**REQUEST FOR PROPOSAL**  
**FINANCIAL MANAGEMENT TRAINING**

Ministry of Housing and Environment (MHE) with assistance from Asian Development Bank (ADB) intends procuring the services of an institute to conduct a financial management training programme for a selective group of candidates.

The main objective of the training is to develop and enhance financial management skills for a selective group of candidates.

The Ministry of Housing and Environment now invites interested eligible Parties to submit Technical and Financial Proposals in accordance with the Request for Proposals available from Ministry of Housing and Environment.

Interested Parties may review the Request for Proposal from <http://www.mhe.gov.mv/v1/> and further information from the address below.

A Party will be selected in accordance with the selection criteria detailed out in the Request for Proposal documents.

Proposals must be delivered to the following address and the person below by 1400 hours (local time) before 13th February 2012 by regular mail.

Project Director  
Regional Development Project – Phase –II, ADB Loan 2170 MLD (SF)  
Ministry of Housing and Environment  
Ameenee Magu, Maafannu  
Male’, Republic of Maldives  
Tel: +960 3004300 Fax: +960 3004301  
E-mail: [secretariat@mhte.gov.mv](mailto:secretariat@mhte.gov.mv)  
Web site: [www.mhe.gov.mv](http://www.mhe.gov.mv)

މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު  
މާލެ، ރިޕުބްލިކް އޮފް މާލްދީބު

(IUL) 18-FS1/138/2012/12 : ސަރުކާރު

ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން 2- ޕްލޭން ސަފްޓް  
2170 ލިއުޑް ލޯން (އެފް.އެލް.އެފް)

ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް

ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން

އެސެޔިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން

ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
<http://www.mhe.gov.mv/v1/>

ވާ، ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން

ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން  
މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
ފިނޭންޝަލް މެނޭޖްމަންޓް ޓްރެއިނިންގ ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން ޕްރޮޖެކްޓް ޖެނެރޭޝަން

މިނިސްޓްރީ އޮފް ހައުސިންގ ޕްލޭނިންގ ޔަންޑް ސަރުކާރު ޖެނެރޭޝަން ޕްރޮގްރާމް ޖެނެރޭޝަން  
މާލެ، ރިޕުބްލިކް އޮފް މާލްދީބު

25 ޖެނުއަރީ 2012



מס' 7-TECH/I/2011/35

תקנה

תקנות המורים למחלקת ההוראה

תקנות מס' 7-TECH/I/2011/35 (א"ת 4 / 2007) הם תקנות המורה כחלק מפרוייקט "הוראה" מס' 2011 ומהוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.

הוראות כלליות

מטרת התקנות

התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה. מטרת התקנות היא להבטיח את איכות ההוראה ולשפר את יעילותה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.

אזורי האחריות

התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.

1. מטרת התקנות היא להבטיח את איכות ההוראה ולשפר את יעילותה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.
2. מטרת התקנות היא להבטיח את איכות ההוראה ולשפר את יעילותה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.
3. מטרת התקנות היא להבטיח את איכות ההוראה ולשפר את יעילותה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.
4. מטרת התקנות היא להבטיח את איכות ההוראה ולשפר את יעילותה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.

התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה. התקנות יתקיימו בהתאמה לתקנות המורה מס' 2011 והוראת המורה למחלקת ההוראה ולמחלקת ההוראה.



საერთაშორისო ტენდერის  
 დოკუმენტი

სერვისი: 188-A/ 2012/ 08

პროცესი

საერთაშორისო ტენდერის პროცესი

საერთაშორისო ტენდერის პროცესი MITSUBISHI - CS1ASRJER - საერთაშორისო ტენდერის პროცესი

1. მონაწილეობის განცხადება
  2. ტენდერის განცხადება (ტენდერის განცხადება)
- დოკუმენტი, რომელიც შეიცავს ტენდერის პროცესის დეტალურ ინფორმაციას (საერთაშორისო ტენდერის პროცესი) 12 თვეს (საერთაშორისო ტენდერის პროცესი) განიცხადებს. მონაწილეობის განცხადებას უნდა მიმართოს მხოლოდ ის, ვინც განიცხადებს მონაწილეობას.

თარიღი	საათი	საათი	საათი
14:00	საათი	01	2012
14:00	საათი	05	2012

საერთაშორისო ტენდერის პროცესი, რომელიც შეიცავს ტენდერის პროცესის დეტალურ ინფორმაციას (საერთაშორისო ტენდერის პროცესი) 12 თვეს (საერთაშორისო ტენდერის პროცესი) განიცხადებს. მონაწილეობის განცხადებას უნდა მიმართოს მხოლოდ ის, ვინც განიცხადებს მონაწილეობას.

❖ ინფორმაციის მისაღებად

- ტელ: 3307314
- ფაქსი: 3303648
- ელფოსტა: [procurement@csc.gov.mv](mailto:procurement@csc.gov.mv)
- ვებ-გვერდი: [www.csc.gov.mv](http://www.csc.gov.mv)

29 ნოემბერი 1433  
 23 იანვარი 2012

საერთაშორისო ტენდერის  
 დოკუმენტი

სერვისი: (IUL)215-AS/1/2012/4

პროცესი

საერთაშორისო ტენდერის პროცესი (IUL)215-FS/1/2012/3 - საერთაშორისო ტენდერის პროცესი

2 ნოემბერი 1433  
 25 იანვარი 2012

**AUDITOR GENERAL'S OFFICE**

Malé, Republic of Maldives

Ref:7- TECH/I/2011/35

**INVITATION TO TENDER FOR EXTERNAL AUDIT SERVICE**

Under the powers conferred on the Auditor General by the Audit Act (04/2007), the Auditor General's Office invites audit firms in the Maldives to express their interest for conducting the external audit of Northern Utilities Limited for the year ended 31 December 2011

**SCOPE OF EXTERNAL AUDIT**

**(1) Audit of the Annual Financial Statements of the Company**

The External Auditor is responsible for auditing the financial statements of the Company for the year 2011, including its accounts in accordance with International Standards on Auditing (ISAs) and issuing a "true and fair view" opinion thereon. They shall also provide an opinion on whether the annual financial statements of the Company have been prepared in accordance with International Financial Reporting Standards (IFRS) or any other applicable reporting framework.

**(2) Other matters on which the External Auditor shall report**

The External Auditor shall, in addition to the audit report, draw attention of the stakeholders to the following:

- a. the profitability, liquidity, stability and solvency of the Company
- b. any significant cases of fraud or losses and, if so, their underlying causes
- c. any internal control weaknesses which were identified and
- d. the general corporate performance indicating
  - achievement against set targets and objectives and
  - whether the finances of the Company have been conducted with due regard to economy, efficiency and effectiveness, having regard to the resources utilized.

Interested firms must submit their proposals on or before 14:00 hours Maldivian time on 2nd February 2012 to the following address:

Auditor General's Office  
3rd Floor, Ghaazee Building  
Ameer Ahmed Magu,  
Male'

A pre-bid meeting will be held on 31st January 2012 at 11:00 hours Maldivian time at the Auditor General's Office.

މި އަންގާ ލިޔުމެއް ބަލާ ފަހަރު، ވަޑައިގަންނަ ގަވާއިދު އިތުރު ލިޔުމެއް ހުށަހަޅާ ހުށަހަޅާ ފަރާތްތަކުން ވަނީ ފުރުޞަތު ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 31 ޖަނުވާލީއާ ގުޅިގެން ދެންނެވުމަށް ލިޔުމެއް ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 02 ފެބްރުއަރީއާ ގުޅިގެން ދެންނެވުމަށް ލިޔުމެއް ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 15:00 ގަޅުން ފެށިގެން ނިންމާ ލިޔުމެއް ހޯދާފައެވެ.

29 ޖަނުވާލީ 1433  
23 ޖަނުވާލީ 2012

މި ލިޔުމެއްގައި ބަލާ ފަހަރު، ވަޑައިގަންނަ ގަވާއިދު އިތުރު ލިޔުމެއް ހުށަހަޅާ ހުށަހަޅާ ފަރާތްތަކުން ވަނީ ފުރުޞަތު ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 31 ޖަނުވާލީއާ ގުޅިގެން ދެންނެވުމަށް ލިޔުމެއް ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 02 ފެބްރުއަރީއާ ގުޅިގެން ދެންނެވުމަށް ލިޔުމެއް ހޯދާފައެވެ. ސަރުކާރުގެ ލިޔުމެއްގެ ފޮތް ލިބިގެން ވަނީ 2012 ވަނަ ވަނަ ދަށުން 15:00 ގަޅުން ފެށިގެން ނިންމާ ލިޔުމެއް ހޯދާފައެވެ.

(IUL)141-YA/1/2012/13

މި ލިޔުމެއްގެ ބޭނުންކުރާ ފަރާތްތަކުން ބަލާ ފަހަރު، ވަޑައިގަންނަ ގަވާއިދު އިތުރު ލިޔުމެއް ހުށަހަޅާ ހުށަހަޅާ ފަރާތްތަކުން ވަނީ ފުރުޞަތު ހޯދާފައެވެ.



سرپرست کارآمد تر است و در سطح کارشناسی ارتقا  
تربیت می دهد، طرفدار است

شماره پرونده: A-380/2012/10

ارجاعات

ارتقای سطح کیفی خدمات

در این خصوص به استناد گزارش کارشناسان  
تیم بررسی در خصوص وضعیت فعلی و همچنین  
بازرسی، نتایج حاصل از بررسی ها، یافته ها،  
در خصوص این موضوع در جلسه کارگزاران  
تاریخ 17 شهریور 1392 و همچنین در تاریخ 2012  
05 و 14 شهریور 1400 در جلسه کارگزاران  
تاریخ 09 شهریور 1392 و همچنین در تاریخ 14-00  
شهریور 1392 در جلسه کارگزاران و همچنین  
در تاریخ 17 شهریور 1392 در جلسه کارگزاران  
تیم بررسی در خصوص وضعیت فعلی و همچنین  
بازرسی، نتایج حاصل از بررسی ها، یافته ها،  
در خصوص این موضوع در جلسه کارگزاران  
تاریخ 17 شهریور 1392 و همچنین در تاریخ 2012  
05 و 14 شهریور 1400 در جلسه کارگزاران  
تاریخ 09 شهریور 1392 و همچنین در تاریخ 14-00  
شهریور 1392 در جلسه کارگزاران و همچنین  
در تاریخ 17 شهریور 1392 در جلسه کارگزاران

نمونه های دیگر در سایر موارد.

1. 831 اصلاحیه شماره (تاریخ 5) روش  
کارشناسی

2. 8484 اصلاحیه شماره تاریخ

3. 277 تغییرات در شماره (8x7) و

4. 63 کسر تاریخ (7x5) و

5. 473 اصلاحیه شماره (7x5) و

6. تاریخ 18x80 (تاریخ شماره و شماره)

تاریخ، 1.5 اصلاحیه شماره 3 و تاریخ شماره

7. تغییرات در شماره (تاریخ و شماره)

'279x428 (تاریخ، شماره شماره 10 و تاریخ 10

تاریخ شماره شماره و تاریخ شماره 3 و تاریخ

6 و تاریخ.

ارتقای سطح کیفی خدمات در خصوص

در خصوص این موضوع در جلسه کارگزاران و همچنین

و تاریخ، در جلسه کارگزاران و همچنین

تاریخ.

29 شهریور 1433

23 شهریور 2012

تاریخ شماره و تاریخ شماره  
شماره شماره و تاریخ شماره

شماره شماره، شماره شماره

تاریخ (20-03)، تاریخ شماره

تاریخ: 3345187 (960)

تاریخ: 3334072 (960)

شماره پرونده: (IUL)COL/1/2012/04

ارجاعات

در این خصوص به استناد گزارش کارشناسان  
تیم بررسی در خصوص وضعیت فعلی و همچنین  
بازرسی، نتایج حاصل از بررسی ها، یافته ها،  
در خصوص این موضوع در جلسه کارگزاران  
تاریخ 10 شهریور 1392 و همچنین در تاریخ 10:00  
شهریور 1392 در جلسه کارگزاران و همچنین  
در تاریخ 7 شهریور 1392 و همچنین در تاریخ 10:00  
شهریور 1392 در جلسه کارگزاران و همچنین  
در تاریخ 17 شهریور 1392 در جلسه کارگزاران

06 شهریور 1433

29 شهریور 2012



**Ministry of Housing and Environment**  
Republic of Maldives

**Maldives Environmental Management Project**

IDA Credit No.: 4427-MV

Reference No.: (IUL)138/PRIV/2012/1

Date: January 30, 2012

**REQUEST FOR EXPRESIONS OF INTEREST**  
**Provision of Community Training Services**

The Government of Republic of Maldives has received a credit from the International Development Association (IDA) towards the cost of Maldives Environmental Management Project, and intends to apply part of the proceeds to payments under the contract for the Services of NGOs, Not for Profit Organisations or similar training service providers to deliver community based training.

The overall objective of the assignment is to provide community training relating to key project themes in targeted 18 islands within the North Region of Republic of Maldives.

To be eligible, the organisations must have previous experience in delivering training to the community in general and to selected interested community groups (CDC, schools, environment clubs) using the critical thinking approach to learning in at least two of the key areas identified below.

- Waste management and small scale composting
- Terrestrial fauna and flora
- Erosion and beach management
- Coral reef ecosystems

The organisations must have past experience in developing and delivering training programs using community tool kits and or other supporting materials. It is proposed that the training will be principally based on or around existing materials developed for the Maldives under MEMP and other previous Projects. The organisation should, however, have the capacity and capability to adapt materials as necessary to make them relevant to the proposed training program. Organisations who are active in the region will have added advantage.

The Ministry of Housing and Environment now invites eligible NGO's, Not for Profit or other organizations to submit their Expressions of Interest (EOI) in providing these services. Interested Organisations must provide information indicating that they are qualified to perform the services (brochures, description of similar assignments, experience in similar conditions, general qualifications and number of key staff and so forth).

An Organisation will be selected based on the qualifications, in accordance with the procedures set out in the World Bank's Guidelines: Selection and Employment of Consultants by World Bank Borrowers" dated January 2011: Selection and Employment of Consultants under IBRD Loans and IDA Credits and Grants by World Bank Borrowers dated January 2011

Interested Organisation may obtain further information at the address below.

The expressions of interest must be delivered to the address (by regular mail, emails or fax) and person specified below before **1100 hours** local time on **February 20, 2012**.

Project Manager  
Maldives Environmental Management Project  
Ministry of Housing and Environment  
Male', Republic of Maldives  
Tel: +960 3004300, Fax: +960 3004301  
E-mail: [memp@mhe.gov.mv](mailto:memp@mhe.gov.mv)      Web site: [www.mhe.gov.mv](http://www.mhe.gov.mv)



س.س.م.ی.ع. 12/012: HPL-ADM/I-2

پێشوازی

پێشوازییەکان

کۆنگرێسی 12/012: HPL-ADM/I-2 ...

کۆنگرێسی 31 ئێنێی 2012 ...

کۆنگرێسی 02 ئێنێی 2012 ...

کۆنگرێسی 10:00 ...

3 ... 26

س.س.م.ی.ع. 2012/13: HPL-ADM/I-2

پێشوازی

پێشوازییەکان

کۆنگرێسی 04: HPL-ADM/I-2012/04 ...

کۆنگرێسی 31 ئێنێی 2012 ...

کۆنگرێسی 06 ئێنێی 2012 ...

کۆنگرێسی 12:00 ...

3 ... 26

کۆنگرێسی 4 -

س.س.م.ی.ع. 2012/14: JS-B

پێشوازی

پێشوازییەکان

کۆنگرێسی 1 -

کۆنگرێسی 2 -

کۆنگرێسی 3 -

کۆنگرێسی 4 -

س.س.م.ی.ع. 2012/14: JS-B

پێشوازی

پێشوازییەکان

کۆنگرێسی 1 -

کۆنگرێسی 2 -

کۆنگرێسی 3 -



مکرمه محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 ڈیوٹی، جیولنگ

سرسہ: 57-B/IU/2012/9

ادھی

مکرمہ محترمہ کی تاریخ جاری

جاری کرتی ہوں مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں

و، جیولنگ مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 5 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 11:00 بجے تک جاری کرتی ہوں  
 8 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 11:00 بجے تک جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں

6 بجے جاری کرتی ہوں 1433  
 29 اگست 2012

مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 ڈیوٹی، جیولنگ

سرسہ: 57-B/IU/2012/13

ادھی

مکرمہ محترمہ کی تاریخ جاری

جاری کرتی ہوں مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں

و، جیولنگ مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 5 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 12:00 بجے تک جاری کرتی ہوں  
 8 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 12:00 بجے تک جاری کرتی ہوں  
 مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں

6 بجے جاری کرتی ہوں 1433  
 29 اگست 2012

مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 ڈیوٹی، جیولنگ

سرسہ: 152-AFS/1/2012/1

ادھی

جاری کرتی ہوں مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 1 اگست (گناہ) کی تاریخ جاری کرتی ہوں  
 و، جیولنگ مکرمہ محترمہ کی تاریخ جاری کرتی ہوں  
 2 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 10:30 بجے تک جاری کرتی ہوں  
 7 اگست 2012 کی تاریخ جاری کرتی ہوں  
 12:00 بجے تک جاری کرتی ہوں

07 بجے جاری کرتی ہوں 1433  
 30 اگست 2012



မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

နံပါတ်: 57-B/IU/2012/10

အမည်

အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

6 မေ 2012

29 မေ 2012

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

နံပါတ်: 57-B/IU/2012/12

အမည်

အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

6 မေ 2012

29 မေ 2012

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

နံပါတ်: 57-B/IU/2012/11

အမည်

အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

6 မေ 2012

29 မေ 2012

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

နံပါတ်: JS-B /14/2012

အမည်

အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

မကွေးတိုင်းဒေသကြီး  
ပြည်ထောင်စု  
အစိုးရအဖွဲ့

3 မေ 2012

26 မေ 2012























فۆنۇمى ئىشلىتىش  
دۆڭ، تېلېفون ئىشلىتىش

سۆيىش: 146-A2/2012/08

مەزمۇنى

مەزمۇنى ئىشلىتىش

دۆڭ 7 تېلېفون ئىشلىتىش 5 سۆيىش سۆيىش  
مەزمۇنى ئىشلىتىش.

دۆڭ، جەنابى، ورناسى شەرتى قىلىش قىلىش  
2012 7 ئىشلىتىش 7 سۆيىش 11:30 ئىشلىتىش  
قۇرۇلۇش سۆيىش سۆيىش 2012 7 ئىشلىتىش  
13 سۆيىش 11:30 ئىشلىتىش سۆيىش سۆيىش  
مەزمۇنى ئىشلىتىش.

دۆڭ سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش (سۆيىش)  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش.

03 مەزمۇنى ئىشلىتىش 1433  
26 ئىشلىتىش 2012

فۆنۇمى ئىشلىتىش  
دۆڭ، تېلېفون ئىشلىتىش

سۆيىش: 146-A2/2012/07

مەزمۇنى

مەزمۇنى ئىشلىتىش

دۆڭ 4 تېلېفون ئىشلىتىش 5 سۆيىش سۆيىش  
مەزمۇنى ئىشلىتىش.

دۆڭ، جەنابى، ورناسى شەرتى قىلىش قىلىش  
2012 7 ئىشلىتىش 7 سۆيىش 30:10 ئىشلىتىش  
قۇرۇلۇش سۆيىش سۆيىش 2012 7 ئىشلىتىش  
13 سۆيىش 12:30 ئىشلىتىش سۆيىش سۆيىش  
مەزمۇنى ئىشلىتىش.

دۆڭ سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش (سۆيىش)  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش.

03 مەزمۇنى ئىشلىتىش 1433  
26 ئىشلىتىش 2012

تېلېفون ئىشلىتىش  
مەزمۇنى ئىشلىتىش  
دۆڭ، تېلېفون ئىشلىتىش

فۆنۇمى: 3345101 (960)

فۆنۇمى: 3344091 (960)

سۆيىش: MNU-CA-FNP/2012/22

مەزمۇنى

دۆڭ سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش (13) /404MNU-CA-FNP/2011  
2011) سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش.

سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش

مەزمۇنى ئىشلىتىش

دۆڭ، جەنابى، ورناسى شەرتى قىلىش قىلىش  
02 ئىشلىتىش 2012 (سۆيىش) سۆيىش 10:00  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش 07 ئىشلىتىش  
2012 (سۆيىش) سۆيىش 10:00 ئىشلىتىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش  
مەزمۇنى ئىشلىتىش.

دۆڭ سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش  
سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش سۆيىش.

06 مەزمۇنى ئىشلىتىش 1433  
29 ئىشلىتىش 2012



ՀՀ-ի Կառավարության կողմից  
 Կառավարության կողմից

ՀՀ-ի (161)-A/IU/2012/006

ՀԱՅԿԱՆՈՒՄ

ՀԱՅԿԱՆՈՒՄ

ՀԱՅԿԱՆՈՒՄ ԿԱՐԳԱՆՈՒՄ ԿԱՐԳԱՆՈՒՄ

Mixing Composition:

	Component	Proportion
1	Soil Mixture (200 tons)	
	Red soil	80%
	Cow Manure	20%
(Max. permissible moisture content:5-7% per 25kg pack)		

Սա հայտարարվում է ՀՀ-ի կառավարության կողմից 2012 թվականի 09 ամսին 2012 թվականի 14:00-ին հայտարարված հայտարարության շրջանում:

Հավելյալ տեղեկություններ համարժեցանքի մասին կարելի է ստանալ հայտարարության կայքից՝ <http://www.hdc.com> և [mv/media/announcements.php](http://mv/media/announcements.php) հասցեի վրա:

Հարցերի և պահանջարկի մասին հարցազրույցներ կարելի է կատարել հեռախոսով՝ 3355193 համարով:

07 ամսին 1433  
 30 ամսին 2012

Սա հայտարարվում է ՀՀ-ի կառավարության կողմից 2012 թվականի 01 ամսին 2012 թվականի 10:00-ին հայտարարված հայտարարության շրջանում:

Հայտարարության մասին հավելյալ տեղեկություններ կարելի է ստանալ հայտարարության կայքից՝ <http://www.hdc.com> և [mv/media/announcements.php](http://mv/media/announcements.php) հասցեի վրա:

Հարցերի և պահանջարկի մասին հարցազրույցներ կարելի է կատարել հեռախոսով՝ 3355193 համարով:

03 ամսին 1433  
 26 ամսին 2012

ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից

ՀՀ-ի (161)-A/IU/2012/023

ՀԱՅԿԱՆՈՒՄ

ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից  
 ՀՀ-ի կառավարության կողմից





آډهټيټي ډي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي

سرسره نمبر: 7-ADHR/I/2012/06

ادھو سٽو

ادھو سٽو ڊي ټي ټي ټي ټي ټي ټي

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

1.1 ادھو سٽو ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
2.3 ادھو سٽو ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

29 آڱيٽ 2012

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

سرسره نمبر: (IUL)220-AF/01/2012/12

ادھو سٽو

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
Fortigate" ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي (310B" (1year license-8x5 bundle  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 2012  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 16:00  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 3339544

02 ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 1433

25 آڱيٽ 2012

ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

سرسره نمبر: (IUL)196-C/1/2012/12

ادھو سٽو

ادھو سٽو ڊي ټي ټي ټي ټي ټي ټي

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
(IUL)196-C/1/2012/5 ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 2012  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 11:00  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 2012  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 11:00  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

07 ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 1433

30 آڱيٽ 2012

ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

سرسره نمبر: C-145/ 2012/04

ادھو سٽو

ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ڊي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 2012  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 11:00  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 2012  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 11:00  
ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي

06 ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي ټي 1433

29 آڱيٽ 2012



مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 ۋە، تەكشۈرۈلۈش

سۈنۈش: (IUL)1-FAO(B)/1/2012/09

مەھسۇلات

مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى

مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى، مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى،  
 2012 يىلى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11:00 نىڭ مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى، 8 مەھسۇلاتلارنىڭ  
 2012 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11:00 نىڭ مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى.

Product	Part no.	Qty
APC Smart-UPS RT 10,000VA RM 230V	SURT10000RMXLI	3
APC Smart-UPS RT 19" Rail Kit	SURTRK2	3
Rack PDU, Basic, 1U, 16A, 230V, (12)C13	AP9565	6
Power chords	AP8704S	10
Power chords	AP8712S	6
Power chords	AP8714S	6
10-32 Hardware Kit	AR8005	2
M6 Hardware Kit	AR8100	2
Replacement battery pack	RBC43	3
NetBotz Rack Monitor 550 (with 240V Power Supply)	NBRK0551	1
APC Temperature Sensor	AP9335T	2
APC Temperature & Humidity Sensor	AP9335TH	2
NetBotz Camera Pod 160	NBPD0160	2
NetBotz Door Switch Sensor for Rooms	NBES0302	2
NetBotz Advanced Software Pack #1	NBWN0005	1

6 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 1433

29 جۈملىسى 2012

ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 2400 نىڭ مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى.

ۋە، مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 05 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11:00 نىڭ مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى، ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11:00 نىڭ مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 12 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 11 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى (ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى) 11 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى.

06 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 1433

29 جۈملىسى S2012

مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى

مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى

سۈنۈش: 69-RA/IL/2012/05

مەھسۇلات

مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 69-RA/IL/2012/01 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى.

ۋە، مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 300  
 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى، 1200 مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى ۋە مەھسۇلاتلارنىڭ تەكشۈرۈلۈشى 2652 جۈملىسى

موقوفہ سرکاری زمینوں پر قبضہ کرنے والے افراد کے خلاف کارروائی کے لیے  
رہن: قومی زمینوں/موقوفہ زمینوں پر

سرسنہ: 269/2012/08

درخواست

مدرسہ اسلامیہ کراچی

کہ درخواست کنندہ نے مذکورہ زمینوں پر قبضہ کرنے کی درخواستیں جمع کرائی ہیں۔

وہ، جن کی تفصیلات درج ذیل ہیں: 01 نومبر 2012ء کو 11:00 بجے  
درخواستیں جمع کرائی گئیں، 05 نومبر 2012ء کو 11:00 بجے  
درخواستیں جمع کرائی گئیں اور 26 نومبر 2012ء کو 14:33 بجے  
درخواستیں جمع کرائی گئیں۔

درخواست کنندہ نے درخواستیں جمع کرائی ہیں اور ان پر کارروائی کی جا رہی ہے۔

03 نومبر 2012ء کو 14:33 بجے  
26 نومبر 2012ء کو 14:33 بجے

**درخواستیں**

درخواستیں جمع کرائی گئیں اور ان پر کارروائی کی جا رہی ہے۔  
رہن: قومی زمینوں/موقوفہ زمینوں پر

سرسنہ: 138-AS6/1389/2012/05

درخواست

کہ درخواست کنندہ نے مذکورہ زمینوں پر قبضہ کرنے کی درخواستیں جمع کرائی ہیں۔  
وہ، جن کی تفصیلات درج ذیل ہیں: 01 نومبر 2012ء کو 11:00 بجے  
درخواستیں جمع کرائی گئیں، 05 نومبر 2012ء کو 11:00 بجے  
درخواستیں جمع کرائی گئیں اور 26 نومبر 2012ء کو 14:33 بجے  
درخواستیں جمع کرائی گئیں۔

06 نومبر 2012ء کو 14:33 بجے  
29 نومبر 2012ء کو 14:33 بجے

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى  
تەرىپىدىن تەييارلانغان

سۈنۈشمەن: (IUL)88-FS/1/2012/5

مەشھۇر

مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچى

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچىنى 2012 يىلى 01 ئاينىڭ 01 كۈنى 11:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. مەشھۇر تەشۋىھچى مەكتۇپلارنى 2012 يىلى 05 ئاينىڭ 05 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. 2012 يىلى 05 ئاينىڭ 05 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ.

29 نەپەس 1433

23 ئاينىڭ 2012

**مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچى**

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى تەرىپىدىن تەييارلانغان

سۈنۈشمەن: 113-PRC/I-2012/15

مەشھۇر

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچىنى 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 11:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. مەشھۇر تەشۋىھچى مەكتۇپلارنى 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ.

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچىنى 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 11:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. مەشھۇر تەشۋىھچى مەكتۇپلارنى 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. 2012 يىلى 06 ئاينىڭ 06 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ.

06 نەپەس 1433

29 ئاينىڭ 2012

سۈنۈشمەن: 113-PRC/I-2012/14

مەشھۇر

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچىنى 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 11:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. مەشھۇر تەشۋىھچى مەكتۇپلارنى 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ.

دېسپوچۈچى مەكتۇپلارنىڭ تارقىتىش ۋاقتىنى بىلدۈرۈش ئورگانى مەشھۇر تەشۋىھ ۋە تەشۋىھچىنى 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 11:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. مەشھۇر تەشۋىھچى مەكتۇپلارنى 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ. 2012 يىلى 07 ئاينىڭ 07 كۈنى 14:00 سائەتتە تارقىتىشقا باشلايدۇ.

06 نەپەس 1433

29 ئاينىڭ 2012

දිනේසරි 2012 ජූලි 29  
දිනේසරි 2012 ජූලි 29

113-PRC/I-2012/16: සේවයේ

අවදානම

113-PRC/I-2012/16: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්  
113-PRC/I-2011/153: සේවයේ අවදානම පිළිබඳව ප්‍රකාශනයක්

06 1433 සේවයේ

29 ජූලි 2012

සේවයේ අවදානම

113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ

(IUL)196-C/11/2012/1: සේවයේ

සේවයේ අවදානම

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

02 (පිටු)

3402/- පිරිසිදු

09:00 සිට 02:00 දක්වා

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ

113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ

(pgoffice@pgoffice.gov.mv)

113-PRC/I-2012/16: සේවයේ  
113-PRC/I-2012/16: සේවයේ

07 1433 සේවයේ

30 ජූලි 2012

سرٹیفکیٹ: (IUL)142-A4/1/2012/06

ادبیات

دیسرے سٹیج پر آئی آر سٹیڈیو آف آرٹس ڈی، جی، جی، جی، جی

ادبیات		1. ڈیڈ	ادبیات سٹیج
01 (ادبیات)		ادبیات سٹیج	
1	ادبیات سٹیج	3	ادبیات سٹیج
2	ادبیات سٹیج	4465/-	ادبیات سٹیج
3	ادبیات سٹیج	1500/-	ادبیات سٹیج
1.	ادبیات سٹیج	ادبیات سٹیج	
2.	ادبیات سٹیج	ادبیات سٹیج	
3.	ادبیات سٹیج	ادبیات سٹیج	
4.	ادبیات سٹیج	ادبیات سٹیج	
5.	ادبیات سٹیج	ادبیات سٹیج	
6.	ادبیات سٹیج	ادبیات سٹیج	

دیسرے سٹیج پر آئی آر سٹیڈیو آف آرٹس ڈی، جی، جی، جی، جی  
ادبیات سٹیج



ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތަށް ބޭނުންކުރާ ގޮތެވެ.

1. ޔަޅުވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތަށް ބޭނުންކުރާ ގޮތެވެ.
2. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.
3. ޔަޅުވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތަށް ބޭނުންކުރާ ގޮތެވެ.

• ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތަށް ބޭނުންކުރާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.

ސަފުޙާ: 06 ވަނަ ބައި 2012 ވަނަ އަހަރުގެ 16:00 ގައި ޖުމްހޫރީ ސަރުކާރުގެ ފަންޓެންޝަލް އިންފްރާސޯޓްރިއާސޯޓް ބޯޕަރޯޓް ގައި ހިމެނޭ ގޮތެވެ.

( ފަންޓެންޝަލް އިންފްރާސޯޓްރިއާސޯޓް )

މަޢުލޫމާތު ހޯޕްލައިން:

މަޢުލޫމާތު ހޯޕްލައިން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.

މަޢުލޫމާތު ހޯޕްލައިން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ: [www.Islamicaffairs.gov.mv](http://www.Islamicaffairs.gov.mv)

މަޢުލޫމާތު ހޯޕްލައިން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. 3315166 ގައި ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.

03 ވަނަ ބައި 1433

26 ވަނަ ބައި 2012

މަޢުލޫމާތު ހޯޕްލައިން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.

ސަފުޙާ: (IUL)142-A4/1/2012/07

މަޢުލޫމާތު

މަޢުލޫމާތު ހޯޕްލައިން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.

	މަޢުލޫމާތު	1. ބަޔާން
	01 (މަޢުލޫމާތު)	މަޢުލޫމާތު ހޯޕްލައިން
1 ވަނަ ބައި	މަޢުލޫމާތު ހޯޕްލައިން	މަޢުލޫމާތު ހޯޕްލައިން
މަޢުލޫމާތު ހޯޕްލައިން 1000/- ރ.	މަޢުލޫމާތު ހޯޕްލައިން 3100/- ރ.	މަޢުލޫމާތު ހޯޕްލައިން
<p>1. ބަޔާން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.</p> <p>2. ބަޔާން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.</p> <p>3. ބަޔާން ލިބިފައިވާ ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ. ތަނުގެ ބޭނުން ހިމަނާ ގޮތެވެ.</p>		



• لاڏينهن جو ڪو به ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

• ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.

ڪم ڪونه ڪيو ويندو.









<p>فوج قیامت کے لئے مقررہ رقم</p>	<p>ان کے لئے رقم مقرر کی گئی ہے۔</p>
<p>01 (1000)</p>	<p>01 (1000)</p>
<p>مقررہ رقم</p>	<p>دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ - رقم مقرر کی گئی ہے۔ 1- دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 2- دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 3- دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 4- دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 5- دیکھو کہ رقم مقرر کی گئی ہے۔</p>
<p>مقررہ رقم</p>	<p>1000</p>
<p>مقررہ رقم</p>	<p>1000</p>
<p>مقررہ رقم</p>	<p>5610/-</p>
<p>مقررہ رقم</p>	<p>2000/-</p>
<p>دیکھو کہ رقم مقرر کی گئی ہے۔</p>	<p>1. دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 2. دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 3. دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 4. دیکھو کہ رقم مقرر کی گئی ہے۔ 5. دیکھو کہ رقم مقرر کی گئی ہے۔</p>





















	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-
2000/-	2000/-	5610/-

	5610/- זכריה
סכום אחוזות	2000/- זכריה
ד"ר ד"ר	<p>1. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>2. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>3. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>4. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>5. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>6. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>7. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>8. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>9. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>10. גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p>
ד"ר	זכריה
א	גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה
ב	גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה
ג	02 (ת"ד)
סכום	<p>ד"ר גבולות המדינה והשטחים המיועדים למגורים ולפעילות אחרות של הממשלה</p> <p>1. תחומי המגורים והפעילות האחרות של הממשלה</p> <p>2. תחומי המגורים והפעילות האחרות של הממשלה</p> <p>3. תחומי המגורים והפעילות האחרות של הממשלה</p>





↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

↖ Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝

Ելակետային տեղեկություններ: human\_resources@bml.com.mv  
Հասցե: Կրթության նախարարության կենտրոն, Կրթական և մշակութային գործունեության զարգացման համար անհրաժեշտ է իրականացնել հետևյալ միջոցառումները՝  
Տեղեկություններ: 05 2012  
Ժամ: 04:00 և ներս













5. Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:
6. Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

**Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:**

- Բաց ֆինանսավորումով իրականացվող գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Լուրջ խնայողականություն պահանջվում է օգտագործել հարկային արձեղծումները:
- Իրականացվող գործերի և ծախսերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:
- Գործերի կատարման համար անհրաժեշտ է օգտագործել հարկային արձեղծումները:

Նշելով, որ Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

Նշելով, որ Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

www.mhrys.gov.mv

Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

Գործը կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը և կատարվում է մինչև 2012 թ. հունիսի 30-ը:

ސަރުކާރުގެ ނަމު: MGPL-HR/AD/12-01

ފޮތް ފޮނުވާ ފޯމު

ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01

01	ބޭނުންވާ ފޯމު
ދަލުގެ ވަނަ ބައި ދިވެހިރާއްޖޭގެ ސަރުކާރުގެ ދަށުން	ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01
3300/- ރ	ފޯމުގެ ނަމު: 01
<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>
<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>
<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>
<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>
<p>05 ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>10:00 ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>
<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>3335614 ފޯމުގެ ނަމު: 01</p> <p>3335615 ފޯމުގެ ނަމު: 01</p> <p>career@maldivegas.com ފޯމުގެ ނަމު: 01</p>	<p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p> <p>ފޮތް ފޮނުވާ ފޯމުގެ ނަމު: 01</p>







9 2012 15:30 3  
 www.mhrys.gov.mv

3347316

1433 6  
 29 2012

MNU-HR/2012/21 30 2012		1
<b>2</b>		
1	3	4,465/-
1,500/-	01	1
2	3	3
3	6	3









9 2012 15:30 3 3  
 www.mhrys.gov.mv

3347316

6 1433  
 29 2012

57-K/IU/2012/08

57-K/IU/2011/94

22

57-K/IU/2011/94

EX 7/B	01
3	3
3	3

<p>2022: 30,000/-</p> <p>1,000/-</p> <p>100/-</p>	<p>2022: 30,000/-</p> <p>1,000/-</p> <p>100/-</p>	<p>EX 6/B</p>	<p>01</p>	<p>100/</p>	<p>EX 6/B</p>
<p>2022: 28,000/-</p> <p>1,000/-</p> <p>100/-</p>	<p>2022: 28,000/-</p> <p>1,000/-</p> <p>100/-</p>	<p>EX1/B</p>	<p>1</p>	<p>100/</p>	<p>EX1/B</p>















መብቅ፡/2012/AN/02 NCHSC

ገንዘብ

ገንዘብ አካባቢው 2012 ዓ.ም. የተጀመረው በገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ:

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።	ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።
ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።	ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ:

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።	ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።
ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።	ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

ገንዘብ አካባቢው ለተሰጠው ገንዘብ ነው።

دې څيزونو ته د ډېر ځير او ډېر ځير لاسوهنې او ډېر ځير  
او ډېر ځير ، ډېر ځير

نومبر: 309/2012/05

د ډېر ځير

د ډېر ځير

د ډېر ځير: ډېر ځير او ډېر ځير

نومبر: 1 ( د ډېر ځير او ډېر ځير )

د ډېر ځير: ډېر ځير او ډېر ځير

د ډېر ځير: 5610.00 ډېر ځير

نومبر او نومبر: 2000.00 ډېر ځير

نومبر او نومبر: 01

د ډېر ځير او ډېر ځير: د ډېر ځير او ډېر ځير / د ډېر ځير او ډېر ځير

1. د ډېر ځير او ډېر ځير

i. د ډېر ځير او ډېر ځير 4 نومبر او ډېر ځير او ډېر ځير 4 نومبر او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير 3 نومبر او ډېر ځير او ډېر ځير

ii. د ډېر ځير او ډېر ځير 5 نومبر او ډېر ځير او ډېر ځير 6 نومبر او ډېر ځير او ډېر ځير

نومبر

2. د ډېر ځير او ډېر ځير 4 نومبر او ډېر ځير او ډېر ځير 3 نومبر او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير نومبر

3. د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

نومبر او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير 3 نومبر او ډېر ځير او ډېر ځير

4. د ډېر ځير او ډېر ځير 1 نومبر او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير 3 نومبر او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

\* د ډېر ځير او ډېر ځير

1. د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

2. د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير

3. د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

5. د ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير او ډېر ځير

د ډېر ځير او ډېر ځير

6. ʻԿՆԵՆԻՑՆԵՐԻ ՆՎԱՐՆԵՐՆԵՐԻ ՀԱՅԿԱՆԵՐԻ ՄԻՍԻ ՓԵՃԱՐ ԿԵՆՏՐՈՆԻՅԱՆ ԿԱՆՈՒՆԱՆԵՐԻ ԿՆԵՆԻՑՆԵՐԻ ԿՐԻՏԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
7. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ՄԻՍԻ ԿՆԵՆԻՑՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
8. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
9. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
10. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
11. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

\* ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ 09:00 ԿՐԻՏԵՐԻՆԵՐԻ 2012 ԿՐԻՏԵՐԻՆԵՐԻ 12:00 ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

\* ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

\* ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

\* ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

\* ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

1. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ( ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝ [www.csc.gov.mv](http://www.csc.gov.mv) ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
2. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ( ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
3. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
4. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
5. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝
6. ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ( ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝

ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ E13-309/2011/74 (08 ԿՐԻՏԵՐԻՆԵՐԻ 2011) ԿՐԻՏԵՐԻՆԵՐԻ ԿՐԻՏԵՐԻՆԵՐԻ՝







10. انصافاً و عدلاً و بحسن نیت و بر مبنای توافق طرفین و بر اساس مقررات مربوطه، کلیه حقوق و تعهدات طرفین در خصوص این قرارداد منتهی به تاریخ انعقاد قرارداد می‌گردد.

11. محترم و ذمه‌دار است و طرفین در صورت بروز هرگونه اختلاف، از طریق مراجع ذیصلاح و بر اساس مقررات مربوطه، اقدام به حل و فصل خواهند کرد.

12. این قرارداد در دو نسخه تنظیم شده و هر یک از طرفین یک نسخه را در اختیار خواهند داشت. هر دو نسخه دارای اعتبار یکسان است.

13. این قرارداد در دو نسخه تنظیم شده و هر یک از طرفین یک نسخه را در اختیار خواهند داشت.

14. در صورت بروز هرگونه اختلاف، از طریق مراجع ذیصلاح و بر اساس مقررات مربوطه، اقدام به حل و فصل خواهند کرد.

تاریخ: ...

محل امضاء و مهر: 1 (انصافاً)

نام و نام خانوادگی: ...

کد ملی: ... 3 (در صورت لزوم)

شماره حساب: 7035-00

شماره کارت: 2000-00

تاریخ: ...

محل امضاء و مهر: ...

ملاحظات:

1. در صورت بروز هرگونه اختلاف، از طریق مراجع ذیصلاح و بر اساس مقررات مربوطه، اقدام به حل و فصل خواهند کرد. ...

2. در صورت بروز هرگونه اختلاف، از طریق مراجع ذیصلاح و بر اساس مقررات مربوطه، اقدام به حل و فصل خواهند کرد. ...

3. در صورت بروز هرگونه اختلاف، از طریق مراجع ذیصلاح و بر اساس مقررات مربوطه، اقدام به حل و فصل خواهند کرد. ...







3. נתינתו אדם ארבעה חובותיו אשר הוציא לאורו ונשכחתי ונשכחתי ונשכחתי, נאמר ונשכחתי ונשכחתי.
4. נאמר ונשכחתי נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
5. נאמר ונשכחתי נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
6. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
7. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
8. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
9. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
10. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.

ד"ר: אדם ונשכחתי ונשכחתי ונשכחתי

נאמר ונשכחתי (נאמר) 02

נאמר ונשכחתי: נאמר ונשכחתי 1

נאמר: נאמר ונשכחתי (נאמר ונשכחתי) 3

נאמר: נאמר ונשכחתי 4465.00

נאמר ונשכחתי: נאמר ונשכחתי 1500.00

נאמר ונשכחתי: נאמר ונשכחתי

נאמר ונשכחתי: נאמר ונשכחתי

נאמר ונשכחתי ונשכחתי:

1. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
2. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.
3. נאמר ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי ונשכחתי.















































<p>2012 08 08</p>	<p>- 2012 08 08 15:00</p>
<p>2012 08 08 15:00</p>	<p>2012 08 08 15:00</p>
<p>2012 08 08 15:00</p>	<p>2012 08 08 15:00</p>
<p>2012 08 08 15:00</p>	<p>2012 08 08 15:00</p>

تاریخ: 29 جنوری 2012  
نمبر: TS/2012/42

قانونی نوٹس

نوٹس: (تعمیراتی)

نیشنل ایئر لائنز (تعمیراتی) (2 ویں بار) 7 اکتوبر 2011ء (1 ویں بار) سے 1 ویں بار  
اگرچہ (تعمیراتی)  
نمبر: 1

1. ایئر لائنز کے لیے 2 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 2 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔
2. ایئر لائنز کے لیے 3 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 3 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔
3. ایئر لائنز کے لیے 4 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 4 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔
4. ایئر لائنز کے لیے 5 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 5 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔
5. ایئر لائنز کے لیے 6 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 6 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔
6. ایئر لائنز کے لیے 7 ویں بار: نیشنل ایئر لائنز کے لیے 7 ویں بار سے پہلے کے تمام قوانین و ضوابط کو منسوخ کر دیا گیا۔



پاڻي ٿيڻ لاءِ ڌار ڌار  
 ڇڏڻ جي اجازت نه ڏيڻ  
 ڏوڏ، ڇڏڻ، ڇڏڻ

**ڏوڏ**

سلسلو نمبر: (IUL)160-A/1/2012/1  
 ڏوڏ: 29 جنوري 2012

ڏوڏ	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار ( ڏوڏ )	ڪم ڪرڻ لاءِ 1
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار 1 ڪم ڪرڻ لاءِ -/150	
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار	ڏوڏ ڪم ڪرڻ لاءِ
ڏوڏ ڪم ڪرڻ:	ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ، پاڻي ٿيڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ	4 ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ.

ڏوڏ	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار ( ڏوڏ )	ڪم ڪرڻ لاءِ 1
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار 1 ڪم ڪرڻ لاءِ -/150	
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار	ڏوڏ ڪم ڪرڻ لاءِ
ڏوڏ ڪم ڪرڻ:	ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ، پاڻي ٿيڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ	4 ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ.

ڏوڏ	ڏوڏ ڪم ڪرڻ ( ڏوڏ )	ڪم ڪرڻ لاءِ 1
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار 1 ڪم ڪرڻ لاءِ -/150	
ڏوڏ:	پاڻي ٿيڻ لاءِ ڌار ڌار	ڏوڏ ڪم ڪرڻ لاءِ
ڏوڏ ڪم ڪرڻ:	ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ، پاڻي ٿيڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ	8 ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ.

- ڏوڏ ڪم ڪرڻ لاءِ
1. ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ
  2. ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ (ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ)
  3. ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ (ڏوڏ ڪم ڪرڻ لاءِ)
  4. ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ

ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ 05 جنوري 2012  
 ڏوڏ ڪم ڪرڻ لاءِ ڌار ڌار ڪم ڪرڻ لاءِ 16:00 ڌار ڌار ڪم ڪرڻ لاءِ













15:00 8 8:30 3341373 <http://www.dhe.gov.mv>

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި  
ބަޔާންކޮށްފައިވާ  
ގޮތުގައި ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން

MNU-CA-RG/2012/26

ދިވެހިސަރުކާރުގެ  
ގެޒެޓްގައި

ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން (ދިވެހި  
ސަރުކާރުގެ ގެޒެޓް)

4 ވަނަ ބައި (8 ވަނަ ބައި)

30 ވަނަ ބައި

13600/- ވަނަ ބައި

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި  
ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 3 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 4 ވަނަ ބައި

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 4 ވަނަ ބައި

20 ވަނަ ބައި

17800/- ވަނަ ބައި

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓްގައި  
ބަޔާންކޮށްފައިވާ ގޮތުގައި ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން 18 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 25 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 18 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 25 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 25 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން

ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން ފަނޑުވާލުމުގެ  
ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 2 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން 1 ވަނަ ބައި  
ފަނޑުވާލުމުގެ ހުކުމުގެ ދަށުން

2012 02 16:00 ވަނަ ބައި



دولة فلسطين  
 وزارة التعليم العالي والبحث العلمي  
 جامعة القدس

سنة 2012/3: 166-Schol/166 (IUL)

18 أغسطس 2012

United Nations/Japan Long-term Fellowship Programme on Nano-Satellite Technologies 2012

المرحلة الأولى: التقديم		المرحلة الثانية: المقابلة	
المرحلة الأولى: التقديم	المرحلة الثانية: المقابلة	المرحلة الأولى: التقديم	المرحلة الثانية: المقابلة
03 أيار 2012	02 أيار 2012	03 أيار 2012	02 أيار 2012
<p>المرحلة الأولى: التقديم</p> <ul style="list-style-type: none"> <li>دعوة التقديم: 03 أيار 2012</li> <li>المرحلة الأولى: التقديم: 03 أيار 2012</li> </ul>		<p>المرحلة الثانية: المقابلة</p> <ul style="list-style-type: none"> <li>02 أيار 2012</li> <li>02 أيار 2012</li> </ul>	
<p>المرحلة الأولى: التقديم</p> <ul style="list-style-type: none"> <li>دعوة التقديم: 03 أيار 2012</li> <li>المرحلة الأولى: التقديم: 03 أيار 2012</li> </ul>		<p>المرحلة الثانية: المقابلة</p> <ul style="list-style-type: none"> <li>02 أيار 2012</li> <li>02 أيار 2012</li> </ul>	
<p>المرحلة الأولى: التقديم</p> <ul style="list-style-type: none"> <li>دعوة التقديم: 03 أيار 2012</li> <li>المرحلة الأولى: التقديم: 03 أيار 2012</li> </ul>		<p>المرحلة الثانية: المقابلة</p> <ul style="list-style-type: none"> <li>02 أيار 2012</li> <li>02 أيار 2012</li> </ul>	



سرچسرو انحصاری

درباره سرچسرو انحصاری و نحوه استفاده از آن

سرچسرو: 69-RA/IL/2012/02

موضوع

سرچسرو انحصاری (فهرست کالاهای) از آنجا که سرچسرو انحصاری و نحوه استفاده از آن

در پی سرچسرو 69-RA/IL/2011/30 (23 آذرماه 1390) و در پی سرچسرو انحصاری و نحوه استفاده از آن

سرچسرو انحصاری از آنجا که سرچسرو انحصاری و نحوه استفاده از آن

1. سرچسرو انحصاری: 9.2 درج
2. سرچسرو انحصاری: 3 درج
3. سرچسرو انحصاری: 4.64 درج
4. سرچسرو انحصاری: درج
5. سرچسرو انحصاری: 6LYA-STP
6. سرچسرو انحصاری: 213 درج
7. سرچسرو انحصاری: 3100 درج
8. سرچسرو انحصاری: 2003 درج
9. سرچسرو انحصاری: 13 درج

در پی سرچسرو انحصاری 350,000/- و سرچسرو انحصاری و نحوه استفاده از آن

سرچسرو انحصاری 5,000/- (فهرست کالاهای) از آنجا که سرچسرو انحصاری و نحوه استفاده از آن

سرچسرو انحصاری از آنجا که سرچسرو انحصاری و نحوه استفاده از آن

1. سرچسرو انحصاری: 16.210 درج
2. سرچسرو انحصاری: 4.410 درج
3. سرچسرو انحصاری: 1.890 درج
4. سرچسرو انحصاری: 13.460 درج
5. سرچسرو انحصاری: درج
6. سرچسرو انحصاری: 2001 درج
7. سرچسرو انحصاری: 4CH درج

8. ארבע שנים רישום: 78

9. שנים רישום: 1500

10. ארבע שנים רישום: 2001

התקשרות זו היא חלק מהסכם המכר והרכישת הנכס המפורט להלן, והיא תכנס לתוקף כשהיא תחת אחריות של 250,000/- (תשע מאות אלף שקל) תמורתה. אחריות זו תכנס לתוקף כשהיא תחת אחריות של 5,000/- (חמש מאות שקל) תמורתה.

התקשרות זו נכנסת לתוקף כשהיא תחת אחריות של 250,000/- (תשע מאות אלף שקל) תמורתה. אחריות זו תכנס לתוקף כשהיא תחת אחריות של 5,000/- (חמש מאות שקל) תמורתה. אחריות זו תכנס לתוקף כשהיא תחת אחריות של 5,000/- (חמש מאות שקל) תמורתה. אחריות זו תכנס לתוקף כשהיא תחת אחריות של 5,000/- (חמש מאות שקל) תמורתה.

הסכם זה מסומן באמצעות מס' 7787269 מסמך מס' 29.

29 סעיף 1433

23 סעיף 2012

הסכם המכר והרכישת הנכס

הסכם המכר והרכישת הנכס המפורט להלן

מס' 69-RA/IL/2012/03

הסכם

הסכם המכר והרכישת הנכס המפורט להלן

הסכם המכר והרכישת הנכס

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

2. חתימתו של המוכר: 3 דפים

3. חתימתו של הקונה: 4-64

4. חתימתו של המוכר: 3 דפים

5. ארבע שנים רישום: 2003

6LYA-STP

6. ארבע שנים רישום: 213

7. שנים רישום: 3100

8. ארבע שנים רישום: 2003

9. חתימתו של המוכר: 13 דפים מס' 1994

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

הסכם המכר והרכישת הנכס מס' 69-RA/IL/2011/31

2012 29 2012 15 2012 23

2012 29 2012 23

7992630 1433 29 2012 23

360 - 02/2011/A

5

5 100 35000/- 100 40000/- 50 25000/- 20 10000/- 20 10000/-

#	مۆھلەت	بىر ئايلىق	سۈمۈر قىممىتى	بىر ئايلىق ئىشلىتىش
01	68	35000/-	100	100
02	64	40000/-	100	100
03	60	25000/-	50	50
04	48	10000/-	20	20
05	23.5	10000/-	20	20

02 2012 15:00 3 9630277 7710875 6700601

28 2012 22





















සංඛ්‍යා: (IUL) 220-RPP/1/2012/10

**මාදිලිය**

2011/05 (වැරදි පිටපත් කිරීමේ පනත) 10 වන වගුවේ (ඔ) වගුවේ,  
 15 වන වගුවේ (අ) වගුවේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ,  
 පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ,  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ.

1	දින 01 වනදා පැවැත්වූ	9	වැරදි පිටපත් කිරීමේ පනතේ
2	වැරදි පිටපත් කිරීමේ පනතේ	10	වැරදි පිටපත් කිරීමේ පනතේ
3	වැරදි පිටපත් කිරීමේ පනතේ	11	වැරදි පිටපත් කිරීමේ පනතේ
4	වැරදි පිටපත් කිරීමේ පනතේ	12	වැරදි පිටපත් කිරීමේ පනතේ
5	වැරදි පිටපත් කිරීමේ පනතේ	13	වැරදි පිටපත් කිරීමේ පනතේ
6	වැරදි පිටපත් කිරීමේ පනතේ	14	වැරදි පිටපත් කිරීමේ පනතේ
7	වැරදි පිටපත් කිරීමේ පනතේ	15	වැරදි පිටපත් කිරීමේ පනතේ
8	වැරදි පිටපත් කිරීමේ පනතේ	16	වැරදි පිටපත් කිරීමේ පනතේ

වැරදි පිටපත් කිරීමේ පනතේ [www.mira.gov.mv](http://www.mira.gov.mv) වෙබ් අඩවියේ දැක්වෙන්නා වූ වැරදි පිටපත් කිරීමේ පනතේ

24 වන වගුවේ 1433  
 18 වන වගුවේ 2012

වැරදි පිටපත් කිරීමේ පනතේ 01 වන වගුවේ  
 2 වන වගුවේ වැරදි පිටපත් කිරීමේ පනතේ,  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ,  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ,  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ,  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ, වැරදි පිටපත් කිරීමේ පනතේ.

29 වන වගුවේ 1433  
 23 වන වගුවේ 2012

වැරදි පිටපත් කිරීමේ පනතේ  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ  
 (IUL)425-A1/1/2012/9  
**මාදිලිය**  
 වැරදි පිටපත් කිරීමේ පනතේ

වැරදි පිටපත් කිරීමේ පනතේ









01	ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ސަލާސަތު ދުވަހުގެ ތެރޭގައި	13-09-2011	ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް
----	---	------------	-------------------------

06 ވަނަ ބައި 1433  
2012 ގެ ޖަނުއަރީ 29

މިސަރުކާރުގެ ގެޒެޓް ގައި  
ބަޔާންކުރި ގޮތުގައި

ސަރުކާރުގެ ގެޒެޓް: TAM/01/2012

ފުލުހުގެ

ދިވެހިސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި ގޮތުގައި  
06 ވަނަ ބައި 1433 ގެ ޖަނުއަރީ 29 ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި

2012 ވަނަ ބައި 1433 ގެ ޖަނުއަރީ 29

1. 2011 ވަނަ ބައި 1433 ގެ ޖަނުއަރީ 29 ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި
2. ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި
3. ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި
4. ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި
5. 2012 ވަނަ ބައި 1433 ގެ ޖަނުއަރީ 29 ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި
6. ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި  
ގޮތުގައި ފުލުހުގެ ސަރުކާރުގެ ގެޒެޓް ގައި ބަޔާންކުރި

28 ޖަނުއަރީ 2012

**Educational Supervision and Quality Improvement Division**

Ministry of Education  
Male', Republic of Maldives  
Phone: 3341215 Fax: 3320206  
e-mail: ap\_sec@moe.gov.mv

No: (IUL)/22-AP/2012/7  
Date: 23 January 2012

**Open invitation for members to participate in Whole School Supervision 2012**

Supervision is the evaluation process which encourages best practices for schools and provides professional evaluation and guidance for further planning and development. Supervision teams allow participating members to gain a better understanding of the school system across the nation, and to share their professional knowledge and experiences to improve the quality of education provided.

In order to make use of qualified and experienced education personnel for the supervision of schools, the Ministry of Education is opening up the opportunity to express interest for this work so that the ministry can maintain a registry of qualified personnel for supervision. An allowance of Rf 1200 will be paid to each member of the supervision team as an incentive. When supervision is conducted in an island, transportation, food and accommodation will be arranged by the Ministry of Education.

Interested candidates may send their profiles along with a letter, addressed to the Director of the Educational Supervision and Quality Improvement Division (9<sup>th</sup> floor, Velaanaage). Or email to [ap\\_sec@moe.gov.mv](mailto:ap_sec@moe.gov.mv) on or before 29<sup>th</sup> February 2012. The profile should contain the applicant's name, address, ID card number, contact number, educational qualifications, teaching experiences and present place of employment. For more information please contact 3341205, 3341202, 3341210, and 3341211.



සංඛ්‍යා: 2012/01/14 (IUL)220-AA/01/2012/14

බැංකු පනතින් පිටත පවතින බැංකු සේවාවන්

බැංකු පනතින් පිටත පවතින බැංකු සේවාවන් පිළිබඳව විධිමත් කිරීමේ පනතේ 12 වන වගන්තියට අනුව බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.

2004 වසරේ ජනවාරි මස 20 දිනට පැවැත්වූ රජයේ සේවා කමිටුවේ 12 වන වගන්තියට අනුව බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. 2011 දී 12 වන වගන්තියේ වෙනස් කිරීම් සිදු කළ අතර, බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. 2011 වසරේ ජනවාරි මස 20 දිනට පැවැත්වූ රජයේ සේවා කමිටුවේ 12 වන වගන්තියේ වෙනස් කිරීම් සිදු කළ අතර, බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.

2004 වසරේ ජනවාරි මස 20 දිනට පැවැත්වූ රජයේ සේවා කමිටුවේ 12 වන වගන්තියට අනුව බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.

www.mira.gov.mv බැංකුවේ වෙබ් අඩවියේ සිට බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. 3339584 සංඛ්‍යාව යටතේ බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය. 05 1433 28 වන දිනට පැවැත්වූ රජයේ සේවා කමිටුවේ 12 වන වගන්තියේ වෙනස් කිරීම් සිදු කළ අතර, බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.

සංඛ්‍යා: 134-CORP/I-KFFP/2012/04

දිනය: 2012/01/19

බැංකු පනතින් පිටත පවතින බැංකු සේවාවන් පිළිබඳව විධිමත් කිරීමේ පනතේ 12 වන වගන්තියට අනුව බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.

1-0 කොටස

බැංකු පනතින් පිටත පවතින බැංකු සේවාවන් පිළිබඳව විධිමත් කිරීමේ පනතේ 12 වන වගන්තියට අනුව බැංකු සේවාවක් සැපයීමට බැංකුවක් සූදානම් විය යුතුය.



תְּכַנְסֵהוּ וְנִשְׂכַּח מֵעֵינֶיךָ מִן הַמָּדַע וְלֹא תִּזְכָּר אֵת הַמַּדְרֹשׁ הַזֶּה וְעַד כִּי יִבְרָא לְךָ אֱלֹהִים וְתִּזְכָּר אֵת הַמַּדְרֹשׁ הַזֶּה וְעַד כִּי יִבְרָא לְךָ אֱלֹהִים וְתִּזְכָּר אֵת הַמַּדְרֹשׁ הַזֶּה... (The text continues with a similar structure, repeating the phrase about forgetting the teaching until one is created by God.)

### 2.0 תְּכַנְסֵהוּ וְנִשְׂכַּח מֵעֵינֶיךָ וּבְסוּמִיָּה

הַיְיָ אֱלֹהֵינוּ יִזְכָּרנוּ בְּהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו וּבְהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו... (The text describes the power of the Lord God, our God, in remembering us through His mighty deeds and power.)

### 3.0 אֱלֹהֵינוּ יִזְכָּרנוּ בְּהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו

אֱלֹהֵינוּ יִזְכָּרנוּ בְּהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו וּבְהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו... (The text continues with a similar structure, repeating the phrase about God remembering us through His mighty deeds.)

### 4.0 וְנִשְׂכַּח מֵעֵינֶיךָ וּבְסוּמִיָּה

אֱלֹהֵינוּ יִזְכָּרנוּ בְּהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו וּבְהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו... (The text continues with a similar structure, repeating the phrase about God remembering us through His mighty deeds.)

### 5.0 וְנִשְׂכַּח מֵעֵינֶיךָ וּבְסוּמִיָּה

אֱלֹהֵינוּ יִזְכָּרנוּ בְּהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו וּבְהַחֲזֹקוֹתָיו וּבְהַשְׁתָּלְכָתוֹתָיו... (The text continues with a similar structure, repeating the phrase about God remembering us through His mighty deeds.)



3323932  
389  
3323932

ap\_sec@moe.gov.mv  
3320206  
(IUL)/22-AP/2012/7

3341215  
3320206  
(IUL)/22-AP/2012/7

3341202, 3341205, 3341210, 3341211

3341210, 3341211, 3341202, 3341205

28  
23

1200

# Maldives Industrial Fisheries Company Limited

Ref. No: 134-CORP/I-KFFP/2012/04

Date: 19<sup>th</sup>. January 2012

## INVITATION FOR EXPRESSION OF INTEREST (EOI) FOR PROVATIZATION OF KANDUOYIGIRI FRESH FISH PLANT

### **1.0 Introduction**

Kandu Oyi Giri Fresh Fish Plant (KFFP) is a state owned fully equipped export and transshipping facility of fresh tuna. The board of Maldives Industrial Fisheries Company Ltd (MIFCO) decided to exit from its tuna based operations to support initiation of aquaculture development program. Privatization of KFFP would benefit local fishing industry by promoting competition, raising efficiency and productivity, thus reducing the size and presence of public sector in the economy. Therefore, MIFCO wishes to privatize KFFP through sublease or joint-venture with foreign and/or local investors. Investment in KFFP offers an excellent opportunity for export of varieties of fresh tuna products, fishing related service and support service for long-lining operations.

### **2.0 Facilities at KFFP**

KFFP is a government-owned transshipment, processing and export facility with modern cooling, freezing, ice-making and storage facilities. KFFP provides complete support for long-liners transshipping their catch to EU and other international markets. The facility is located at the vicinity of Male' International Airport and capital Male'.

### **3.0 Objectives and Scope**

We are seeking companies with experience in the fishing industry who can own, develop, market and manage the export facility, possibly in conjunction with a long-lining fleet and value-added processing operation at the land area allocated to KFFP. The project aims to lease the land, properties and other commercial activities at the best commercial rates. The project will benefit local fishing community through employment, trade, promotion of competition and productivity. MIFCO benefits in initiating long impending aquaculture programs and support services in developing and managing quarantine facility and marine hatchery at KOG.

### **4.0 Criteria**

All applicants must be able to fulfil the following criteria:-

1. Ability to raise finance.
2. Experience in executing and successfully implementing large scale fisheries or fisheries related development projects.
3. Work-in-Progress: Provide a complete work-in-progress schedule for all work under contract, showing % complete.
- 4 Describe current banking arrangements and contact information.

Only shortlisted parties will be issued the Request for Proposal (RFP).

### **5.0 Evaluation Process**

1. The EOI does not constitute a solicitation. MIFCO reserves the right to amend or cancel the requirements at any time during the EOI and/or solicitation process. Thus, submitting a reply to an EOI does not automatically guarantee that the firm will be considered for receipt of the solicitation when issued.
2. Upon receipt of the EOI, a preliminary evaluation based on the background and capacity of the parties will be conducted to shortlist the potential candidates.
3. Shortlisted candidates will be invited for detailed discussions, to survey the proposed location, and a Request for Proposal (RFP) will be sent to the candidates based on the discussions conducted.
4. Parties selected may also propose business models that may best suit them.
5. All queries and clarifications shall be directed to:

Mr. Mohamed Matheen

Director of the board of directors  
 Maldives Industrial Fisheries Company Ltd,  
 Block 389, Hilaalee Magu,  
 Male', Maldives.  
 Tel: 3323932; Fax: 3323955

**6.0 Composition of EOI**

1. Letter of Application indicating: Name, title address and telephone number of the Principal who will serve as the Contact for this project. The Principal must have been empowered to sign the Legal Agreement with MIFCO and make decisions for the firm on contractual matters.
2. Details of the individual, firm, company or consortium, including company profile, expertise, resource capacity and experience
3. Brief background of senior management personnel
4. Following documents providing proof of financial capacity to undertake the project, but not limited to;
  - a. Last 3 years total turnover of the participant and other financial information to illustrate the financial position and status of the bidding entity and/or its parent.
  - b. Evidence of adequacy of working capital for this Project (access to line(s) of credit and availability of other financial resources)
  - c. Authority to seek references from the individual, firm, company or consortium's bankers
  - d. Proposed business model(s) for the Project.
5. If the project is taken by a Joint Venture partnership; A letter of intent jointly signed by Senior Partners/CEOs of all firms, as part of their EOI submission. The Letter of Intent is to include the following:
  - a. Undertaking that the firms will be working as a Joint Venture for the purposes of the project
  - b. Specialties/ areas of work that each individual firm will be responsible for
  - c. Lead firm for contact for the project. For the purposes of the project, MIFCO will deal with the Lead Firm.

**7.0 Closing Date**

EOI is due for submission at the address below no later than 15:00 hours on 09<sup>th</sup>. February 2012. Amendments to the date and/or other changes to the process, if any, will be published in the press. EOI should be submitted in a sealed envelope addressed to:

EXPRESSION OF INTEREST FOR KFFP  
 Mr. Mohamed Matheen  
 Director of the board of directors  
 Maldives Industrial Fisheries Company Ltd,  
 Block 389, Hilaalee Magu,  
 Male', Maldives  
 Tel: 3323932; Fax: 3323955

އިދާރާތަކުން ފޮނުވާލެވޭ ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން  
 ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން  
 ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން ސަބަބު ހުރި ގޮތުން

<p>ސަބަބު ހުރި ގޮތުން 2012 26 ޖެނުއަރީ 2012</p>	<p>ސަބަބު ހުރި ގޮތުން 2012 26 ޖެނުއަރީ 2012</p>
<p>ސަބަބު ހުރި ގޮތުން 2012 26 ޖެނުއަރީ 2012</p>	<p>ސަބަބު ހުރި ގޮތުން 2012 26 ޖެނުއަރީ 2012</p>

<p>ባንክና ስፔሪየር ክሮኒንግ</p>	<p>ክሮኒንግ ደንብና ስፔሪየር ክሮኒንግ ስርዓት አወጣጥቶ ስራውን ለማቆም ይረዳል።</p> <ol style="list-style-type: none"> <li>1. ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>2. በደንብ 25 ስርዓት ውስጥ ስራውን ለማቆም ይረዳል።</li> <li>3. ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>4. ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>5. ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>6. ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> </ol>
<p>ክሮኒንግ ክሮኒንግ</p>	<p>ደንብና ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</p> <ol style="list-style-type: none"> <li>1. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>2. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>3. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>4. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>5. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>6. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>7. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>8. ደንብና ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> </ol>
<p>ደንብና ስፔሪየር ክሮኒንግ</p>	<p>ደንብና ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</p> <ol style="list-style-type: none"> <li>1. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>2. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>3. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>4. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> <li>5. ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</li> </ol>
<p>ደንብና ስፔሪየር ክሮኒንግ</p>	<p>ደንብና ስፔሪየር ክሮኒንግ ስርዓት ደንብን ይረዳል።</p> <p>www.judiciary.gov.mv</p>

دسره پوښتنې ته چې د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده

نومبر: (IUL)88-LS/1/2012/3

د ښار په اړه ده

د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده

25 نومبر 1433

19 د نومبر 2012

د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده

نومبر: (IUL)425-M/1/2012/8

د ښار په اړه ده

د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده

د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده  
د ښار په اړه ده، د ښار په اړه ده، د ښار په اړه ده

02 د نومبر 1432

25 د نومبر 2012

